







CIN: L24231GJ1988PLC011652

May, 20th 2024

To,

**BSE Limited** 

Listing Compliance & Legal Regulatory Phiroze Jeejeebhoy Towers,

Dalal Street, Mumbai - 400 001

Stock Code: 543233

To,

National Stock Exchange of India Limited

Listing & Compliance

Exchange Plaza, Bandra-Kurla Complex,

Bandra East, Mumbai 400 051

**Stock Symbol: CHEMCON** 

Dear Sir/Madam,

Subject: Newspaper Advertisement - Audited Financial Results for the quarter and financial year ended March 31, 2024

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Audited Financial Results for the quarter and financial year ended March 31, 2024 were published on 20<sup>th</sup> May, 2024 in the following newspapers:

- 1. Loksatta Jansatta (Gujarati)
- 2. Business Standard (English)

A copy of the results published is attached herewith. These are also being made available on the website of the Company at <a href="www.cscpl.com">www.cscpl.com</a>.

You are requested to take the above information on record.

Thanking you,

Yours faithfully,

For Chemcon Speciality Chemicals Limited

Shahilkumar Kapatel

**Company Secretary & Compliance Officer** 

Membership No.: A52211

Corporate Office: 9th Floor, Onyx Business Center, Akshar Chowk, Old Padra Road, Vadodara - 390 020. INDIA Tel.: +91 265 2981195/

2983754, Email: info@cscpl.com

Regd. Office : Block No. 355, Manjusar - Kunpad Road, Village: Manjusar, Taluka: Savli, Dist.: Vadodara - 391 775. INDIA

Tel.: +91 2667 264104

Website: www.cscpl.com

# કોમોડિટી વાયદાઓમાં રૂ.૯,૪૦૯ કરોડ અને ઓપ્શન્સમાં રૂ. ૨૯,૨૬૫ કરોડનું ટર્નઓવર



કોટન-ખાંડીના ભાવમાં રૂ. ૨૨૦નો સુધારો: મેન્થા તેલ મામુલી વધ્યું

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.૩૮,૬૭૮.૬૨ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.૯,૪૦૯.૨૨ કરોડનો

સોનાના વાયદાઓમાં એમસીએક્સ અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં રૂ.૪૪૩ વધી રૂ.૮૭,૬૦૦ બોલાઈ ૧૦ ગ્રામદીઠ રૂ.૭૨,૯૦૭ના રહ્યો હતો. ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂં.૭૩,૧૩૫ અને નીચામાં રૂ.૭૨,૮૩૩ ના મથાળે અથડાઈ, ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ

અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.

૨૯૨૬૫.૨૦ કરોડનો હતો.

રૂ.૯ વધી રૂ.૭,૧૭૧ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૩૫ વધી રૂ.૭૩,૦૩૧ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં ૧ કિલોદીઠ રૂ.૮૭,૧૧૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૮૭,૭૯૮ અને નીચામાં રૂ.૮૬,૯૦૦ ના મથાળે અથડાઈ, રૂં.૪૪૧ વધી રૂ.૮૭,૭૪૧ ના સ્તરે બોલાઈ રહૃાો હતો. ચાંદી-મિની જૂન કીમતી ધાતુઓના વાયદાઓમાં કોન્ટ્રેક્ટ રૂ.૪૫૯ વધી રૂ.૮૭,૫૯૮

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ મે વાયદો રૂ.૮૯૪.૨૦ના ભાવે રૂં.૧૧૦ વધી રૂ.૭૩,૦૯૦ના ખૂલી, રૂ.૮.૩૦ વધી રૂ.૯૦૨.૬૦ જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.૦.૦૫ ઘટી રૂ.૨૩૮ તેમ જ રૂ.૬૨ વધી રૂ.૫૯,૦૨૬ અને સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.૦.૫૦ વધી ફેરફાર વગર રૂ.૬,૬૧૬ બોલાઈ રૂ.૩,૦૬૫.૬૯ કરોડનાં અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૂ.૧૯૫ના ભાવ થયા હતા. જસત મે રહ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો ચાદીના વિવિધ વાયદાઓમાં તો, એમસીએક્સ પર બુલડેક્સ

ભાવ થયા હતા. મિની વાયદાઓમાં ભાવે ખૂલી, રૂ.૩ વધી રૂ.૨૧૧.૧૦ એલ્યુમિનિયમ-મિની મે વાયદો ૧ અને નેચરલ ગેસ-મિની મે વાયદો કિલોદીઠ રૂ.૦.૧૦ વધી રૂ.૨૩૯ ૩.૧ વધી ૨૧૧.૨ બોલાઈ સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.o.૪૦ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝના વધી રૂ.૧૯૪.૪૦ જસત-મિની મે વાયદાઓમાં એમસીએક્સ કોટન વાયદો રૂ.૧.૨૫ વધી રૂ.૨૬૨.૪૦ બોલાઈ રહૃાો હતો.

એમસીએક્સ ક્રૂડ તેલ મે વાયદો રૂ.પદ,૩૦૦ અને નીચામાં

કોન્ટ્રેક્ટ રૂ.૧.૩૦ વધી રૂ.૨૬૩ના ૧ એમએમબીટીયૂદીઠ રૂ.૨૦૯ના રૂ.૨,૪૯૯.૦૨ કરોડનાં વેપાર વાયદામાં રૂ.૪.૨૦ કરોડનાં ૪૫ ખાંડી મે વાયદો સત્રની શરૂઆતમાં ૧ ખાંડીદીઠ રૂ.૫૬,૧૦૦ના ભાવે એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં

સોનામાં રૂ.૧૧૦ અને ચાંદીમાં રૂ.૪૪૧ની તેજી: એલ્યુમિનિયમ સિવાયની બિનલોહ ધાતુઓમાં વૃદ્ધિ બલડેક્સ વાયદામાં રૂ.૪.૨૦ કરોડનાં કામકાજ

ક્રૂડ તેલ-મિની મે વાયદો કોઈ

સત્રની શરૂઆતમાં ૧ બેરલદીઠ રૂ.૫૬,૧૦૦ ના મથાળે અથડાઈ, રૂ. દ, દ૧ દના ભાવે ખૂલી, દિવસ રૂ. ૨૨૦ વધી રૂ. ૫ દ, ૩૦૦ના સ્તરે દરમિયાન ઉપરમાં રૂ. દ, દુ૪૫ પહોંચ્યો હતો. મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ અને નીચામાં રૂ.૬,પે૮૬ ના ૧ કિલોદીઠ રૂ.૧ વધી રૂ.૯૨૬.૩૦ મથાળે અથડાઈ, રૂ.૩ વધી બોલાયો હતો. કામકાજની દષ્ટિએ રૂ.૬,૬૧૮ બોલાયો હતો, જ્યારે એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં

થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.૭૫૭.૫૮ કરોડનાં ૧૭,૯૧૦ લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.૧,૪૫૫.૩૬ કરોડનાં ૭૩,૪૨૫ લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.૧૬૬.૫૭ કરોડનાં ૨,૪૦૬ લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.૩૫.૬૦ કરોડનાં પ૬૭ લોટ તાંબાના વાયદાઓમાં રૂ.૧,૦૫૬.૦૫ કરોડનાં ૪,૬૮૮ લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.૩૬૬.૭૮ કરોડનાં પ,૩૨૦ લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.૩.૦૧ કરોડનાં ૧૧ લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.૩.૫૭ કરોડનાં ૧૦૬ લોટનાં કામકોજ થયાં

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ

લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં ૪૫૨ લોટના સ્તરે રહૃાો હતો. બુલડેક્સ મે વાયદો ૧૮,૬૨૮ પોઈન્ટ ખૂલી, ઉપરમાં ૧૮,૬૯૫ અને નીચામાં ૧૮,૬૧૫ બોલાઈ, ૮૦ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૩૭ પોઈન્ટ વધી ૧૮,૬૮૬ પોઈન્ટના સ્તરે પહોંચ્યો

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. ૨૯૨૬૫.૨૦ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં બેનેના મર્જરને લીલી ઝંડી પણ સકારાત્મક નોંધ પર બંધ થયા કોલ ઓપ્શન્સની વાત કરીએ તો કૂડ તેલ જૂન રૂ.૬,૬૦૦ સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ ૧ બેરલદીઠ રૂ.૧૯૮.૬૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૨૦૯.૮૦ અને નીચામાં રૂ.૧૭૭.૭૦ ના મથાળે અથડાઈ, રૂ.પ.૪૦ ઘટી રૂ.૧૮૭.૮૦

છેલ્લા બે મહિનામાં કપાસ (કપાસ શંકર ૬)ના ભાવમાં લગભગ ૮ ટકાનો ઘટાડો

## IDFC લિમિટેડને IDFC ફર્સ્ટ બેંક સાથે મર્જ કરાશે

IDFC લિમિટેડ IDFC ફર્સ્ટ બેક્ર સાથે મર્જ થવા જઈ રહી છે. IDFC શેર ૦.૨૫ ટકા વધીને ૭૭.૪૫ ના ફર્સ્ટ બેંકના શેરધારકોએ IDFC સ્તરે બંધ થયો હતો. એક વર્ષ અગાઉ લિમિટેડ સાથે બેંકના વિલીનીકરણને શેર રૂ. ૬૭ની સપાટીથી નીચે હતો. મંજૂરી આપી છે. બેંકે માહિતી આપી જો કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સ્ટોક છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની ૧૦૦ના સ્તરની નજીક પહોંચી ચેન્નાઈ બેંચ દ્વારા બોલાવવામાં આવેલી ગયો હતો. ડિસેમ્બર ૨૦૨૩માં, બેઠકમાં બહુમતી શેરધારકોએ આ મંજૂરી આપી છે.

પર મતદાનના પરિણામની જાણકારી NCLTને આપી હતી. તેમણે કહ્યું કે મર્જરની યોજનાની તરફેણમાં ફર્સ્ટ બેક્રે જુલાઈમાં મર્જરને મંજૂરી ૯૯.૯૫ મત પડ્યા હતા. ટૂંક આપી હતી. નિષ્ણાતોના મતે આ સમયમાં આ અંગે

ટ્રેડિંગ સેશન દરમિયાન દ્રઝ<del>-</del> તરફથી લીલી ઝંડી મળવાની કંપનીના શેર રૂ. ૧૧૬.૯૫ની શકચતાઆો દિવસની સૌથી ઊંચી છે. અહેવાલો સપાટીએ પહોંચ્યા હતા અનુસાર, NCLT સમયમાં

આપી શકે છે. અગાઉ ગયા વર્ષે ૨૭ હતા. IDFC લિમિટેડનો શેર સપાટ ડિસેમ્બરના રોજ IDFC લિમિટેડે રૂ.૧૧૪.૩૫ પર બંધ રહ્યો હતો. કહ્યું હતું કે RBI એ IDFC લિમિટેડ, ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીના શેર IDFC FHCL અને IDFC ફર્સ્ટ રૂ. ૧૧૬.૯૫ની દિવસની સૌથી ઊંચી બેક્રના મર્જર માટે NOC આપી છે. સપાટીએ પહોંચ્યા હતા. બીજી તરફ, ગયા વર્ષે, જુલાઈ ૨૦૨૩ માં, IDFC IDFC ફર્સ્ટ બેક્રનો શેર ૦.૨૬ ટકાના FHCL, IDFC અને IDFC કર્સ્ટ વધારા સાથે રૂ. ૭૭.૪૪ પર બંધ થયો બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ મર્જરને હતો. જો કે, બેંકના શેર રૂ. ૭૭.૫૦ લીલી ઝંડી આપી હતી. શનિવારના પર દિવસની ટોચે પહોંચી ગયા હતા.

ભાવ વધારાની આશાએ કપાસ

વેચાણ કરવાનું ટાળતા ખેડૂતો

વિશેષ સત્રમાં, IDFC ફર્સ્ટ બેક્રના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો અને રિઝર્વ બેંકે IDFC અને તેની બેંકિંગ પેટાકંપની IDFC ફર્સ્ટ બેંકના રિવર્સ બેંકના બોર્ડે મર્જરની દરખાસ્ત મર્જરને મંજૂરી આપી હતી. જ્યારે IDFC ફાયનોન્સિયલ હોલ્ડિંગ કંપની લિમિટેડ, IDFC લિમિટેડ અને IDFC

> નિર્ણય બાદ IDFC ફર્સ્ટ બેક્રના શેરમાં વધારો જોવા મળી શકે છે. શનિવારે, IDFC લિમિટેડ અને IDFC કર્સ્ટ બેંકના **શે**ર

## શેરબજારમાં રોકાણ કરો છો તો આ જાણવું જરૂરી

# આ સપ્તાહે કંપનીઓના પરિણામો. વૈશ્વિક વલણો અને વિદેશી રોકાણકારો શેરબજારની મુવમેન્ટ નક્કી કરશે



નવી દિલ્હી,તા.૧૯ ગત સપ્તાહે શેરબજારમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. આ અઠવાડિયે ઘણા પરિબળો બજારની ચાલને અસર કરશે. જો તમે શેરબજારમાં રોકાણ કરો છો તો તેના વિશે જાણવું તમારા બજારની વધઘટ બજારની દિશા માટે જરૂરી છે. આ અઠવાડિયે, માટે મહત્વપૂર્ણ રહેશે. ONGC, કંપનીઓના ત્રિમાસિક પરિણામો, SAIL, BHEL, JK Tyre, વૈશ્વિક વલણો અને વિદેશી One97 Communications. રોકાણકારોની વ્યવસાયિક પ્રવ્ર Power Grid, InterGlobe ત્તિઓ બજારનો વલણ નક્કી Aviation, ITC અને કરશે. વિશ્લેષકોએ આ અભિપ્રાય NTPC સપ્તાહ દરમિયાન વ્યક્ત કર્યા છે. આ સપ્તાહે ઓછા તેમના ત્રિમાસિક પરિણામાં માને છે કે હાલમાં ચાલી રહેલી સર્વિસિસના સિનિયર વાઈસ સામાન્ય ચૂંટણીઓને કારણે પ્રેસિડેન્ટ અરવિંદર સિંહ નંદાએ રોકાણકારો હવે સાવધ અભિગમ જણાવ્યું હતું કે, ''આ અઠવાડિયે અપનાવી શકે છે. મુંબઈમાં બજારનો અંદાજ મુખ્ય સ્થાનિક લોકસભા ચૂંટણીના પાંચમા અને વૈશ્વિક આર્થિક ડેટા દ્વારા તબક્કાના મતદાનને કારણે નક્કી કરવામાં આવશે. ભારતમાં સોમવારે શેરબજાર બંધ રહેશે. ઁરેં મેન્યુફ્રેક્ચરિંગ અને સર્વિસ નિષ્ણાંતોના મતે ચોથા ક્વાર્ટરના સેક્ટરનો ડેટા આવવાનો છે. પરિણામની સિઝન પુરી થવામાં આ સિવાય બ્રિટનનો ફગાવો, છે. કંપનીઓના સારા પરિણામો અમેરિકાના બેરોજગારીના દાવા, મૂંઝવણમાં ફસાયેલા બજારને S&Pની વૈશ્વિક સેવાઓ અને થોડી રાહત આપી શકે છે. તેમણે વૈશ્વિક ઉત્પાદન ડેટા આવવાના જણાવ્યું કે યુએસ સેન્ટ્રલ બેંક છે.

Place: Vadodara

Date: May 18, 2024

ફેડરલ રિઝર્વના ચીફ જેરોમ પોવેલ સોમવારે સંબોધન કરશે. આ બજારના સેન્ટિમેન્ટને અસર કરી શકે છે. તેમણે કહ્યું કે આ સિવાય જાપાન અને અમેરિકાના આર્થિક ડેટા અને વૈશ્વિક ચલણ ટ્રેડિંગ સેશનનું રહેશે. વિશ્લેષકો જાહેર કરશે. માસ્ટર કેપિટલ

# પાંચમા તબક્કામાં

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના હોલીડે કેલેન્ડર ૨૦૨૪ મુજબ લોકસભાના તબક્કાના પમા મતદાનને કારણે સોમવાર ૨૦ મેના રોજ ઘણા શહેરોમાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો બંધ રહેશે. ઓડિશા, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, લદ્દાખ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, બિહાર અને જમ્મુ-કાશ્મીરમાં પાંચમા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, ૨૦ મેના રોજ બેલાપુર અને નાણાકીય હબ મુંબઈમાં બેંકો બંધ રહેશે.૨૦મી મેના રોજ બંધ થયા પછી, મે ૨૦૨૪ના મહિનામાં ૨૩મી મેના રોજ બુદ્ધ પૂર્ણિમા અને ૨૫મી મેના રોજ નઝરૂલ જયંતિ અને લોકસભાની સામાન્ય ચૂંટણીના છેંદ્રા ચોથો શનિવાર છે. ૨૬મી મે (રવિવાર)ના રોજ પણ બેંકો બંધ છે.ભારતમાં ૨૦૨૪ માટે બેંકની છે. નાણાકીય વ્યવહારો માટે આ અઠવાડિયે બેંક

# મતદાનને અનુલક્ષી ૪૯ શહેરોમાં આજે બેંકો બંધ મુંબઈ,તા.૧૯

તબક્કાની બેંક રજાઓ રહેશે. ૨૫મી મે પણ છે. કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયાના રજાઓ દરેક રાજ્ય અને શહેર પ્રમાણે બદલાય ટકાનો ઘટાડો થયો છે. કપાસના ભાવ ઘટીને શાખાઓની મુલાકાત લેવાનું આયોજન કરતા બે મહિના પહેલા ૧૫ માર્ચ ૨૦૨૪ના રોજ ગ્રાહકોએ આ તારીખોની નોંધ લેવી જોઈએ.૨૦ આ જ કપાસનો ભાવ ૧૭,૪૩૪ રૂપિયા મેના રોજ, લોકસભા ચૂંટણીના પ તબક્કાના ભાગ પ્રતિ ક્વિન્ટલ બોલાઈ રહ્યો હતો. જ્યારે રૂપે, છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના ૪૯ એક વર્ષ પહેલા શંકર ૬ જાતના કપાસનો મંડીઓમાં કપાસની કિમત લઘુત્તમ ટેકાના રહ્યો છે. જો કે, આ વર્ષે કપાસના ઓછા બ્રાઝિલ અને તુર્કીમાં સારા કપાસના પાકને મતવિસ્તારોમાંથી લગભગ ૬૯૫ ઉમેદવારો માટે 🛮 ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. ૧૬,૭૫૯ હતો. 🐧 ભાવ (એમએસપી) કરતા વર્ષારે છે, છતાં 🖯 ઉત્પાદનને ધ્યાનમાં લેતા, એવો અંદાજ 🗸 ચીન અને ભારતમાં ઓછા પાકને સરભર મતદાન શરૂ થશે.

મુંબઇ,તા.૧૯ કપાસના ભાવમાં ઘટાડો બે મહિનાથી ચાલી રહ્યો છે. બીજી તરફ ખેડૂતોને લાગે છે કે આ વર્ષે ઓછા ઉત્પાદનને કારણે કપાસના ભાવ ચોક્કસપણે વધશે. ખેડૂતોના આ અંદાજને કારણે હાલમાં બજારોમાં કપાસની આવક પણ ઘટી રહી ડેટા અનુસાર, છેલ્લા બે મહિનામાં કપાસ (કપાસ શંકર ૬)ના ભાવમાં લગભગ ૮ રૂ.૧૬,૦૫૭ પ્રતિ ક્વિન્ટલ થયા છે. જ્યારે

મુજબ ઓક્ટોબર-માર્ચ દરમિયાન કપાસની નિકાસ ૧૩૭ ટકા વધીને ૧૮ લાખ ગાંસડી થઈ હતી. જ્યારે ગયા વર્ષે સમાન સમયગાળામાં નિકાસ ૭.૫૯ લાખ ગાંસડી હતી. ઝછેંના નવા અંદાજ મુજબ, આગામી સમયમાં કપાસની આવકમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે કારણ કે વર્ષ ઉત્પાદનમાંથી લગભગ ૨૮૦.૬ લાખ ગાંસડીનું આગમન થયું છે.નિષ્ણાંતોના મતે જો કપાસના ભાવમાં ઘટાડો આમ જ ચાલુ રહેશે તો ખેડૂતો માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. ભલે તેઓ તેને સ્ટોર કરે કે વેચે, તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મહારાષ્ટ્રની મોટાભાગની

#### બે મહિના પહેલા ૧૫ માર્ચ ૨૦૨૪ના રોજ આ જ કપાસનો ભાવ ૧७,૪૩૪ ३पिया प्रति डिवन्टल બોલાઈ રહ્યો હતો

રહ્યા છે. જેના કારણે બજારોમાં કપાસની આવક ઘટી રહી છે. વાયદા બજારમાં પણ કપાસના ભાવમાં કોઈ મોટો ફેરફાર ૨૦૨૩-૨૪માં ૩૨૩.૧ લાખ ગાંસડીના નથી. જીસ્ઝ કોમોડિટી રિસર્ચ અનુસાર, હાલમાં કપાસ સ્ઝઠ પર રૂ. ૫૬,૦૦૦-૫૭,૫૦૦ પ્રતિ કેન્ડી (એક કેન્ડી ૩૫૫ કિલોની છે)ના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ, કપાસ (એપ્રિલ ૨૦૨૫) વાયદાના ગાંસડી ૧૭૦ કિગ્રા) થવાનો અંદાજ છે. ભાવ ૧,૫૩૦-૧,૫૮૦ની રેન્જમાં ટ્રેડ આગામી સિઝનમાં વૈશ્વિક ઉત્પાદનનો થવાની ધારણા છે.મહારાષ્ટ્રના બજારોમાં અંદાજ ૧૧૯ મિલિયન યુએસ ગાંસડી કપાસના ભાવમાં સતત ઘટાડો જોવા મળી (૨૧૭.૭૨ કિગ્રા) છે.યુએસડીએ યુએસ, કોટન એસોસિયેશનના નવા અંદાજ ખેડૂતો હજુ પણ ઊંચા ભાવની રાહ જોઈ છે કે તેની કિંમત ૨૦૨૧ અને ૨૦૨૨ની કરવાની અપેક્ષા રાખે છે.

જેમ ૯,૦૦૦ થી ૧૨,૦૦૦ રાપવા પ્રતિ ક્વિન્ટલ થઈ શકે છે. કપાસના ભાવ અંગે વૈશ્વિક અંદાજ શું છે?૧ ઓગસ્ટથી શરૂ થનારી ૨૦૨૪-૨૫ની સિઝનમાં બ્રાઝિલ અને તુર્કીની સાથે યુએસમાં કપાસના ઊંચા પાકની અપેક્ષાએ વૈશ્વિક કપાસના ભાવ ઘટી રહ્યા છે. ફિચ સોલ્યુશન્સ રિસર્ચ એજન્સી મ્સેં કહે છે કે વૈશ્વિક કપાસ બજારમાં મંદીનું સેન્ટિમેન્ટ મોટાભાગે ૨૦૨૪-૨૫માં ઉત્પાદન રિકવરીને કારણે છે, ખાસ કરીને યુએસમાં ઊંચા ઉત્પાદનની અપેક્ષાને કારણે.તે જ સમયે, ૨૦૨૪-૨૫ સીઝનમાં અમેરિકામાં કપાસનું ઉત્પાદન વધીને ૧૬૦ લાખ ગાંસડી (૨૦૪.૯

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝકરતાં LICએ વધુ કમાણી કરી: TCSને સૌથી વધુ નુકસાન

**Particulars** 

(before Tax, Exceptional and Extraordinary Items)

6 Total Comprehensive Income for the period [Comprising Profit for

the period (after Tax) and other Comprehensive Income (after tax

(after Exceptional and Extraordinary Items)

(after Exceptional and Extraordinary Items)

7 Equity Share Capital (Face Value of Rs.10/- each)

discontinued operations (not annualised)

g Earnings per Share (of Rs. 10/- each) for continuing and

ગયા સપ્તાહે મ્જીઈના ૩૦ શેરોવાળા સેન્સેક્સમાં ૧,૩૪૧.૪૭ પોઈન્ટ અથવા ૧.૮૪ ટકાનો ઉછાળો નોંધાયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને BSE એ ૧૮ મેના રોજ ઈક્વિટી અને ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ખાસ ટ્રેડિંગ સેશન યોજ્યું હતું. ઉદ્દેશ્ય પ્રાથમિક સ્થળ પર મોટી વિક્ષેપો અથવા નિષ્ફળતાનો સામનો કરવા માટે અમારી તૈયારીની ચકાસણી કરવાનો હતો. સેન્સેક્સની ટોચની

આઠની માર્કેટ મૂડી (માર્કેટ કેપ) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતની કંપની ગયા સપ્તાહે રૂ. ૧,૪૭,૯૩૫.૧૯ અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બેક્રનું મૂલ્યાંકન રૂ. ૨૧,૧૩૬.૭૧ કરોડ વધી છે. લાઈફ ઈન્સ્યોરન્સ મુકેશ અંબાણીએ સપ્તાહ દરમિયાન કરોડ વધીને રૂ. ૧૧,૧૪,૧૬૩.૨૯ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને રૂં. ૩૬,૪૬૭.૨૬ કરોડ ઉમેર્યા કરોડ થયું હતું. ICICI બેકનું માર્કેટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ અને તેનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. કેપિટલાઇઝેશન રૂ. ૯,૫૭૦.૬૮ કાયદો થયો હતો. LICનું મૂલ્યાંકન ૧૯,૪૧,૧૧૦.૭૦ કરોડ થયું. કરોડ વધીને રૂ. ૭,૯૪,૪૦૪.૫૧

1 Total Income from Operations

4 Net Profit for the period before Tax

5 Net Profit for the period after Tax

2 | Net Profit for the period

3 Exceptional Items

8 Other Equity

a) Basic (Rs.)

b) Diluted (Rs.)

Place: Vadodara

Date : 18th May, 2024

રૂ. ૪૦,૧૬૩.૭૩ કરોડ વધીને રૂ. ભારતી એરટેલનું માર્કેટ કેપ રૂ. કરોડ થયું છે.

STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31<sup>ST</sup> MARCH 2024

Regd. Office: P.O. Ranoli - 391 350, Dist. Vadodara (Gujarat)

Tel. No.: (0265) 2232768, Fax No.: (0265) 2230029, Email ID : Investors@gipcl.com

Website: www.gipcl.com, CIN: L99999GJ1985PLC007868

31.03.2024

See Note No. 3

38,964.40

8,515.22

8,515.22

6.617.65

5.999.81

15,125.12

4.38

31.03.2024

Audited

25,251.69

25,251.69

20,793,45

15,125.12

3,15,426.11

13.12

૧૦ સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી ૬,૧૬,૨૧૨.૯૦ કરોડ થયું હતું. ૨૬,૪૯૨.૬૧ કરોડ વધીને રૂ. ૭,૬૪,૯૧૭.૨૯ કરોડ અને HDFC

**GUJARAT INDUSTRIES POWER COMPANY LIMITED** 

[Rs. in Lakhs]

Corresponding

Quarter ended

4.30

IA/19(AHM)2022 in CP(IB) 499 of 2019 Dharit Kishorbhai Shah Liquidator Maktel Control & Systems Pvt Ltd V/s Manoj Narendrakumar Patel Suspended Management of Maktel Control & Systems Pvt Ltd (R-1) Narendrabhai Manilal Patel Suspended Management of Maktel Control & System Pvt. Ltd. (R-2)

NCLT/AHM/Publ./ IA/19(AHM)2022 in CP(IB) 499 of 2019/1275/2024 Notice of Next Date of Hearing An application under section 66 of the Insolvency and Bankruptcy Code, 2016 was file

GOVERNMENT OF INDIA / भारत सरकार

NATIONAL COMPANY LAW TRIBUNAL / राष्ट्रीय कंपनी विधि अधिकरण AHMEDABAD BENCH / अहमदाबाद बेंच

1st and 2nd Floor, Corporate Bhawan / पहली और दूसरी मंजिल, कोपोरेट भवन, Beside Zydus Hospital, Off S.G. Highway / जाइडस अस्पताल के पास, ऑफएस.जी. हाईवे

Thaltej, Ahniedabad-380 059. / थलतेज, अहमदाबाद - ३८० ०५९. Phone No.: (079) 2685 4591, Email : courtofficr-ahm@nclt.gov.in

by Dharit Kishorbhai Shah liquidator of Maktel Control & Systems Pvt Ltd. and was listed on 03.05.2024 and the said application is now fixed for hearing before the Hon'ble Adjudicating Authority, NCLT Ahmedabad on 24.06.2024. As per the direction issued by the Hon'ble Adjudicating Authority vide its order dated

03.05.2024, the respondents i.e Manoj Narendrakumar Patel and Narendrabhai Manila Patel is hereby directed to remain present either personally and/or through authorize person or through an advocate or Professional duly appointed by you, as may be advised, on 24.06.2024 before the National Company Law Tribunal, Ahmedabad Bench. TAKE NOTICE that in default of your appearance the matter will be heard and determined in your absence in accordance with the provisions of law.

NCLT Ahmedabad Bench Place: Ahmedabad

બેંક ઓફ બરોડા,પાણીગેઢ શાખા : Bank of Baroda

૧૬/એ . વિઠાંગ કો .-ઓપ . ઠાઉસીંગ સોસાયટી જેને મંદીર સામે, આજવા રોડ, વડોદરા-૩૯૦૦૧લ (सिड्योरीटी र्घन्टरेस्ट(એन्ફोर्समेन्ट) नियमो २००२ना पूर्णो नियम ८(१)हे6ण)

થી, નીચે સહી કરનાર **બેંક ઓફ બરોડા,પાણીગેટ શાખા, ૧૬/એ, વિહાંગ કો.-ઓપ. હાઉસીંગ સોસાયટી, જૈન મંદીર સામે, આજવા રોડ, વડોદરા-૩૯૦૦૧૯**ના અધિકૃત અધિકારી તરી<sup>કુ</sup> सेड्योरीटार्राजेशन એन्ड रिङन्स्ट्रङ्शन ओङ् झर्रनान्सियत એसेट्स એन्ड એन्झेर्सभेन्ट ओः સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨ ના ૫૪)હેઠળ અને સિક્યોરીટી ઈન્ટરેસ્ટ(એન્ફોર્સમેન્ટ નેચમો ૨૦૦૨ના નિચમ ૩ સાથે વંચાતી કલમ ૧૩ (૧૨) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરી ai. ૦૫-૧૨-૨૦૨૩ ની તારીખની કથિત કિમાન્ડ નોટીસ જારી કરીને દેવાદાર મે. સંદીપ એન્ટરપ્રાઈઝ અને તેના પ્રોપ શ્રી સંદીપ પ્રવિણભાઇ મિસ્ત્રીને નોટીસમાં જણાવેલ રૂા. ૧૪,૪૮,૮૦૯.૯૪/- (રૂપિયા ચૌદ **નાખ અડતાલીસ હજાર આઠસો સાત અને ચુમ્મોતેર પેસા પુરા) ૦૪/૧૨/૨૦૨૩** મુજબ સાથે તેની ઉપર અગાઉનું

ત્યાજ અને પ્રાસંગીક ખર્ચા એટલે કે **જ/૧૨/૨૦૨૩ થી** દું દિવસની અંદર ચુકવવા જણાવ્યું હતું. દેવાદારો રકમની પરત ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા આથી, અહીં દેવાદાર/જામીનદાર અને જાહેર જનતાન નોટીસ આપી જણાવવાનું કે નીચે સહી કરનારે નીચે વર્ણવેલી મિલકતનો કબજો આ કાયદાની કલમ ૧૩(૪) ને નિયમ ૮ સાથે વંચાણે લઈને સિક્ટ્યોરીઇ ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને **૧७મી મે , ૨૦૨૪ ના રોજ લઈ લીધો છે.** 

સિક્ચોર્ડ મિલકતો છોડાવવા માટે ઉપલબ્ધ સમય અંગે, એક્ટની કલમ ૧૩ની પેટા-કલમ (૮) ની

જોગવાઈ પ્રત્યે દેવાદારનું ધ્યાન દોરવામાં આવે છે. ખાસ કરીને દેવાદારો/જમીનદારો અને જાહેર જનતાને મિલકત સાથે કોઈપણ વ્યવહાર ન કરવાન ચેતવણી આપવામાં આવે છે અને મિલકત સાથે કરાચેલા કોઈપણ વ્યવહારનો ચાર્જ **બેંક ઓફ** બરોડા,પાણીગેટ શાખા, ૧૬/એ, વિહાંગ કો.-ઓપ. હાઉસીંગ સોસાયટી, જેન મંદીર સામે, આજવા રોડ, વડોદરા-૩૯૦૦૧૯ ની બાકી ૨કમ રૂા. ૧૪,૪૮,૮૦७.७૪/- (રૂ**પિયા ચોદ લાખ અડતાલી**ર **હજાર આઠસો સાત અને ચુમ્મોતેર પૈસા પુરો) ૦૪/૧૨/૨૦૨૩** મુજબ સાથે તેની ઉપર અગાઉનું વ્યાવ અને પ્રાસંગીક ખર્ચા એટલે કે **૦૪/૧૨/૨૦૨૩ થી** ૬૦ દિવસની અંદર ચુક્વણીને આદિન રહેશે. સિક્ચોર્ડ મિલકતો છોડાવવા માટે ઉપલબ્ધ સમય અંગે, એક્ટની કલમ ૧૩ની પેટા-કલમ (૮) ન

જોગવાઈ પ્રત્યે દેવાદારનું ધ્યાન દોરવામાં આવે છે મિલકતનું વર્ણન

खावर रहेणांड भिवडत **५वोड नं.એ./२७** छे. જे १०५ चोरस मीटर मापना प्वीट વિસ્તાર અને કોમન રોડ અને પ્લોટનો અવિભાજિત હિસ્સો છે, જે "**નંદનવન હાઉસિંગ કોમ્પ્લેક્સ**"માં ૨૫ ચો૨સ મીટ૨ની આસપાસ છે , જે આ૨ એસ નં .૪૩૭/૧ , ૪૩૮ ટી પી નં .૩ એફ પી નંબર ૭૫૨, ૭૫૪ ૭૫૯ કુલ માપ ૮૬૫૨ ચોરસ મીટર મોજે દંતેશ્વર, ૨જીસ્ટ્રેશન જીલ્લો અને સબ જીલ્લો વડોદરા ખાતેની જમીન પર બાંધવામાં આવી રહી છે . ચતુઃસીમા **પૂર્વ :** પ્લોટ નં .એ/૨૬ , **પશ્ચિમ:** પ્લોટ નં .એ/૨૮ , **ઉત્તર:** પ્લોટ નં .બી/૨૪ સોસાયટી ૬ મીટ૨

રોડ . **દક્ષિણ:** ૭.૫ મીટરનો આંતરિક માર્ગ . ારીખઃ ૧७.૦૫.૨૦૨૪ થળ : વકોદરા સહી/- અધિકૃત અધિકારી બેંક ઓફ બરોડ

31.03.2023 See Note No. 3 43,348.51 8,375.53 8,375.53 15,125.12

Notes: The above is an extract of the detailed format of Audited Financial Results for the year ended on 31st March, 2024 filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015. The full format of the Audited Financial Results is available on websites of Stock Exchanges viz. www.bseindia.com and www.nseindia.com and on Company's website (www.gipcl.com).

2. The Audited Financial Results have been reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on 18th May, 2024. Figures of the quarter ended 31st March, 2024 and 31st March, 2023 are the balancing figures between audited figures in

respect of full financial year and the published year to date figures up to the third quarter ended 31st December, 2023 and 31st December, 2022 respectively which were subject to limited review by Statutory Auditors.

The Statutory Auditors have carried out an audit of the financial results for the year ended 31st March, 2024 and have issued an unmodified opinion on the same The Board of Directors have recommended payment of Dividend of Rs. 3.95 per Equity Share (i.e. 39.5%) for the year

The Company has designated an exclusive e-mail ID viz. investors@gipcl.com for investor grievance redressal.

For Gujarat Industries Power Company Limited **Managing Director** 

### Chemcon Speciality Chemicals Limited (AN ISO 9001:2015 and ISO 14001:2015 Certified Company)

Regd. Office: Block Number 355, Manjusar Kunpad Road, Manjusar Village, Taluka Savli, Vadodara 391775, Gujarat Email: investor.relations@cscpl.com | Website: www.cscpl.com | Tel: +91 265 2981195 | CIN: L24231GJ1988PLC011652

(Rs. in Lacs								
	Particulars	Qı	Quarter Ended			Ended		
		31/03/2024	31/12/2023	31/03/2023	31/03/2024	31/03/2023		
		(Audited)	(Unaudited)	(Audited)	(Audited)	(Audited)		
Ι	Total income from operations	6,292.93	5,632.30	8,196.84	28,027.66	31,619.94		
П	Net Profit/(Loss) for the period	415.51	606.17	1,420.72	2,625.76	7,415.14		
	(before Tax, Exceptional and/or Extraordinary items)							
Ш	Net Profit/(Loss) for the period before tax	415.51	606.17	1,420.72	2,625.76	7,415.14		
	(after Exceptional and/or Extraordinary items)							
IV	Net Profit/(Loss) for the period after tax	290.32	444.35	1,047.01	1,919.30	5,511.01		
	(after Exceptional and/or Extraordinary items)							
V	Total Comprehensive Income for the period	290.61	439.47	1,035.95	1,904.94	5,482.92		
	[comprising Profit/(Loss) for the period (after tax)	,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,						
	and Other Comprehensive Income (after tax)]							
VI	Equity Share Capital	3,663.07	3,663.07	3,663.07	3,663.07	3,663.07		
VII	Other Equity	-	-	-	-	42,072.84		
VIII	Earning Per equity Share (FV ₹ 10/- Per share)	0.79	1.21	2.86	5.24	15.04		
	basic & Diluted (in ₹)*	5.01 (5)	123			1,5,1,5,3		

\* EPS as presented above is not annualised except for the year ended March 31, 2023 and March 31, 2024. Notes:

1. The above is an extract of the detailed format of Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the Company's website at www.cscpl.com and the Stock Exchange's Website at www.bseindia.com and www.nseindia.com.

> By order of the Board For Chemcon Speciality Chemicals Limited

Kamalkumar Rajendra Aggarwal Chairman & Managing Director DIN: 00139199









# Personal Finance, Monday to **Saturday**

To book your copy, sms reachbs to 57575 or email order@bsmail.in



## Chemcon Speciality Chemicals Limited

(AN ISO 9001:2015 and ISO 14001:2015 Certified Company)

EXTRACT OF STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2024

Regd. Office: Block Number 355, Manjusar Kunpad Road, Manjusar Village, Taluka Savli, Vadodara 391775, Gujarat CHEMCON Email: investor.relations@cscpl.com | Website: www.cscpl.com | Tel: +91 265 2981195 | CIN: L24231GJ1988PLC011652

						(Rs. in Lacs)		
	Particulars	Qı	Quarter Ended			Year Ended		
		31/03/2024	31/12/2023	31/03/2023	31/03/2024	31/03/2023		
		(Audited)	(Unaudited)	(Audited)	(Audited)	(Audited)		
	Total income from operations	6,292.93	5,632.30	8,196.84	28,027.66	31,619.94		
Ш	Net Profit/(Loss) for the period	415.51	606.17	1,420.72	2,625.76	7,415.14		
	(before Tax, Exceptional and/or Extraordinary items)							
Ш	Net Profit/(Loss) for the period before tax	415.51	606.17	1,420.72	2,625.76	7,415.14		
	(after Exceptional and/or Extraordinary items)							
IV	Net Profit/(Loss) for the period after tax	290.32	444.35	1,047.01	1,919.30	5,511.01		
	(after Exceptional and/or Extraordinary items)							
٧	Total Comprehensive Income for the period	290.61	439.47	1,035.95	1,904.94	5,482.92		
	[comprising Profit/(Loss) for the period (after tax)							
	and Other Comprehensive Income (after tax)]							
VI	Equity Share Capital	3,663.07	3,663.07	3,663.07	3,663.07	3,663.07		
VII	Other Equity	-	-	-	-	42,072.84		
VIII		0.79	1.21	2.86	5.24	15.04		
	basic & Diluted (in ₹)*							

#### Notes:

Place : Vadodara

Date: May 18, 2024

1. The above is an extract of the detailed format of Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the Company's website at www.cscpl.com and the Stock Exchange's Website at www.bseindia.com and www.nseindia.com.

\* EPS as presented above is not annualised except for the year ended March 31, 2023 and March 31, 2024.

For Chemcon Speciality Chemicals Limited

Kamalkumar Rajendra Aggarwal Chairman & Managing Director DIN: 00139199

**ASTEC** 

Date: May 20, 2024

#### ASTEC LIFESCIENCES LIMITED

Corporate Identity Number (CIN): L99999MH1994PLC076236 Registered Office: "Godrej One", 3rd Floor, Pirojshanagar, Eastern Express Highway, Vikhroli (East),

Mumbai – 400 079, Maharashtra Tel.: +91 22 2518 8010 , Fax: +91 22 2261 8289 , Website: www.godrejastec.com , E-mail: astecinvestors@godrejastec.com

#### IMPORTANT NOTICE TO SHAREHOLDERS

TRANSFER OF EQUITY SHARES OF ASTEC LIFESCIENCES LIMITED TO INVESTOR EDUCATION AND PROTECTION FUND (IEPF)
WHEREIN DIVIDEND IS UNPAID / UNCLAIMED FROM THE FINANCIAL YEAR 2016-17

NOTICE IS HEREBY GIVEN to the Shareholders of ASTEC LIFESCIENCES LIMITED ("the Company"), pursuant to the provisions of Section 124(6) of the Companies Act, 2013 ("the Act") read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules  $2016 \ (\text{``the Rules''}) \ [including \ any \ amendment(s) \ / \ modification(s) \ / \ re-enactment(s) \ thereof].$ The Act and the Rules, inter alia, contain provisions for transfer of all shares, in respect of which, Dividend has not been paid or claimed for 7 (Seven

consecutive years or more to Investor Education and Protection Fund ("IEPF") established by the Central Government. However, where there is a specific order of the Court or Tribunal or Statutory Authority restraining any transfer of such shares and payment of Dividend or where such shares are pledged or hypothecated under the provisions of the Depositories Act, 1996, the Company will not transfer such shares to IEPF. Complying with various requirements set out in the Act and the Rules, the Company has sent individual communication to the concerned Shar

on May 19, 2024, at their latest available address(es) registered with the Company and the Registrar and Share Transfer Agents, viz., Bigshare Services Private Limited ("Bigshare"), whose Dividend has remained unpaid or unclaimed for the Financial Year 2016-17 and onwards and therefore, whose Equity Shares are liable to be transferred to IEPF during the Financial Year 2024-25, giving them the opportunity to claim the Unclaimed Dividend and Equity Shares, <u>latest by Wednesday, 28<sup>th</sup> August, 2024</u>, to avoid transfer to IEPF, by making an application to the Company or the Company's Registrar & Transfer Agent, Bigshare, along with all the requisite documents. The concerned Shareholders are requested to send their claims preferably by Friday. 16th August, 2024 in order to allow sufficient time for processing their claims.

The Company has uploaded the list of Shareholders containing details of the names of the Shareholders, Folio Number or DP ID and Client ID and the number of Equity Shares due for transfer to IEPF on its website www.godrejastec.com, which the Shareholders are requested to verify.

Shareholders holding Equity Shares in physical form and whose Equity Shares are liable to be transferred to IEPF may note that the Company will be issuing Duplicate Share Certificate(s) in lieu of the Original Share Certificate(s) held by them for the purpose of transfer of such Equity Shares to IEPF and consequently the Original Share Certificate(s) will stand automatically cancelled and be deemed to be non-negotiable. The Shareholders may further note that the details of the concerned Shareholders uploaded on the website should be regarded and shall be deemed adequate notice in respect of issue of Duplicate Share Certificate(s) by the Company for the purpose of transfer of Equity Shares to IEPF. Shareholders holding Equity Shares in dematerialized mode / electronic mode, may note that the Equity Shares shall be directly transferred to IEPF, with the help of Depository Participants by way of corporate action, without any further notice.

Notice is hereby given that, in case no valid claims in respect of such Equity Shares are received from the Shareholders by the due date or such other date as may be extended under the provisions of law, the Company shall, with a view to comply with requirements set out in the Rules, be compelled o transfer the Equity Shares to IEPF by the due date, as per procedure stipulated in the Rules, without any further notice. Please note that no claim shall lie against the Company in respect of Unclaimed Dividend amount(s) and/or Equity Shares transferred to IEPF.

Kindly note that all the future benefits, including but not limited to, Dividend(s) arising on such Equity Shares would also be credited to IEPF. Shareholder may also note that both the Unclaimed Dividend and the Equity Shares transferred to IEPF, including all benefits accruing on such Equity Shares, if any can be claimed back by them from IEPF after following the procedure prescribed in the Rules, the details of which are available at www.iepf.gov.in For any information / clarifications on the subject matter, concerned Shareholders may write to the Company at astecinvestors@godrejastec.com or contact the Company's Registrar and Share Transfer Agents, viz., Bigshare Services Private Limited, Office No S6-2, 6th Floor, Pinnacle Business Park Next to Ahura Centre, Mahakali Cayes Boad, Andheri (East), Mumbai - 400093, Tel: 022-62638200, E-mail: investor@bigshareonline.com.

A copy of this Notice is made available on the website of the Company, www.godrejastec.com and also on the websites of Stock Exchanges (viz., BSE

Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com). For Astec LifeSciences Limited

Tejashree Pradhan Company Secretary & Compliance Officer



#### JYOTI CNC AUTOMATION LIMITED

Reg. Office: G - 506, Lodhika GIDC, Vill.: Metoda, Dist.: Raikot - 360 021, Gujarat, India. CIN: U29221GJ1991PLC014914; Website: www.jyoti.co.in; E-Mail: investors@jyoti.co.in

#### **Extract of Audited Standalone and Consolidated Financial Results** for the Quarter and Year ended on March 31, 2024

	(Rs. in Millions except per share data								
			STANDALO	NE	CONSOLIDATED				
Sr.	Particulars	Quarter Ended		Year Ended	Quarter Ended		Year Ended		
No.		31.03.2024 (Unaudited)	31.03.2023 (Unaudited)	31.03.2024 (Audited)	31.03.2024 (Unaudited)	31.03.2023 (Unaudited)	31.03.2024 (Audited)		
1	Total income from Operation (Net)	3,965.38	4,395.86	11,975.82	4,531.24	4,567.27	13,449.52		
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extra ordinary Items)	866.60	805.49	1,869.23	1,076.24	527.87	1,849.48		
3	Net Profit/(Loss) for the period before Tax (after Exceptional and/or Extra ordinary Items)	866.60	805.49	1,869.23	1,076.24	832.37	1,849.48		
4	Net Profit/(Loss) for the period after Tax (after Exceptional and/or Extra ordinary Items)	658.35	667.98	1,399.94	996.41	694.85	1,508.61		
5	Total Comrehensive Income for the period [Comprising Profit/(loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	644.43	670.01	1,388.53	982.49	696.95	1,497.20		
6	Equity Share Capital	454.85	329.29	454.85	454.85	329.29	454.85		
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year.	17,110.52	4,508.38	17,110.52	13,191.41	491.15	13,191.41		
8	Earning Per Share (of Rs. 2/- each)								
	1. Basic:	2.94	4.53	7.32	4.45	4.72	7.89		
	2. Diluted:	2.94	4.53	7.32	4.45	4.72	7.89		
Note:	The above is an extract of the detailed format of C	Juarterly / Vear	ly Einancial P	eulte (Standal	one and Cons	olidated) filed	with the Stock		

Note: The above is an extract of the detailed format of Quarterly / Yearly Financial Results (Standalone and Consolidated) filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of financial results for the said Quarter and Year ended are available on Stock Exchanges Websites; www.bseindia.com and www.nseindia.com. The same is also available on the website of the Company: www.jyoti.co.in

For and on behalf of Board of Directors of JYOTI CNC AUTOMATION LIMITED

Parakramsinh G. Jadeia CHAIRMAN & MANAGING DIRECTOR

Date: May 18, 2024 Place: Rajkot

DIN: 00125050 Adfactors 82

CIN: L24117RJ1991PLC006307, Tel. No.: 0141-2770202/03 E-mail address: com.sec@poddarpigmentsltd.com, Website address: www.poddarpigmentsltd.com

Extract of Audited Financial Results for the Quarter and Year Ended 31st March, 2024 (Rs. in Lakh, except per share data) Quarter Ended Quarter Ended Quarter Ended Year Ended Year Ended

REGD. OFFICE: E-10-11 & F-14 TO 16. RIICO INDUSTRIAL AREA, SITAPURA, JAIPUR (RAJASTHAN) - 302022

٥.	Particulars Particulars	Quarter Linded	Quarter Linded	dualito, Ellaca	Tour Endou	Tour Endou
No.	r ai ticulai s	31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2024	31.03.2023
		(Audited)	(Unaudited)	(Audited)	(Audited)	(Audited)
1	Total Income from Operations	9,968.27	9,185.99	8,800.87	37,551.61	34,626.05
2	Net Profit /(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	1,190.30	906.20	983.37	3,886.08	3,689.22
3	Net Profit /(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	1,190.30	906.20	983.37	3,886.08	3,689.22
4	Net Profit /(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	874.64	714.05	745.35	2,881.90	2,734.05
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]		1,126.89	(54.77)	5,469.12	(1,741.59)
6	Equity Share Capital	1,061.00	1,061.00	1,061.00	1,061.00	1,061.00
7	Reserves (Excluding Revalution Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	33,778.77	28,309.65
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)-					
	1. Basic :	8.24	6.73	7.02	27.16	25.77
	2. Diluted :	8.24	6.73	7.02	27.16	25.77
No	tes:					

Place : Chennai

Date : 19th May, 2024

- 1 The above Audited results were reviewed by the Audit Committee of the Board of Directors in its meeting held on 16th May. 2024 and approved by the Board of Directors in the meeting held on 19th May, 2024. The Auditors of the Company have carried out the audit of the same.
- 2 The above is an extract of the detailed format of the result for the quarter and year ended 31st March, 2024 field with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the financial results for the quarter and year ended 31st March, 2024 is available on the Stock Exchange website www.bseindia.com, www.nseindia.com and Company's website www.poddarpigmentsltd.com.
- 3 The Board has recommended Dividend of Rs. 4/- per share, payable subject to the approval of shareholders in the ensuing Annual General Meeting. Total outgo on this account will be Rs. 424.40 Lacs.
- 4 The Company has successfully commissioned the Solar Plant of 3 MWp (3000 KWp) on 28th March, 2024 at Village Jhinjhinyali, Tehsil-Fatehgarh, District- Jaisalmer, Rajasthan,

For and on behalf of the Board of Directors

For Poddar Pigments Limited

S.S. Poddar **Managing Director** DIN: 00058025



## PPAP AUTOMOTIVE LIMITED

Registered Office: 54. Okhla Industrial Estate, Phase-III. New Delhi-110020 Corporate Office: B-206A, Sector-81, Phase-II, Noida-201305, Uttar Pradesh Tel: +91-120-4093901

Website: www.ppapco.in, E-mail ID: investorservice@ppapco.com

(Rs. in lakhs except for EPS data)

## EXTRACT OF CONSOLIDATED FINANCIAL RESULTS OF PPAP AUTOMOTIVE LIMITED AND ITS SUBSIDIARIES AND JOINT VENTURE FOR THE QUARTER AND YEAR ENDED 31st MARCH, 2024 PREPARED IN COMPLIANCE WITH THE INDIAN **ACCOUNTING STANDARDS (IND-AS)**

S.No.	PARTICULARS	Quarter Ended 31-Mar-2024	Year Ended 31-Mar-2024	Year Ended 31-Mar-2023
		Audited (Ref. Note 5)	31-Mar-2024 Audit	
1	Revenue from operations	13,570.08	52,291.77	51,111.22
2	Net Profit / (Loss) for the period before tax and exceptional items	(93.88)	(805.42)	(511.29)
3	Net Profit / (Loss) for the period before tax (after exceptional items)	(93.88)	(805.42)	(511.29)
4	Net Profit / (Loss) for the period (after tax and exceptional items)	(815.73)	(1,303.87)	(594.43)
5	Total Comprehensive Income / (loss) for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	(798.02)	(1,251.86)	(612.33)
6	Profit attributable to: (a) Owners of the Company (b) Non-controlling interest	(815.73)	(1,303.87)	(594.43)
7	Paid-up equity share capital (Face Value of Rs. 10/- each)	1,400.00	1,400.00	1,400.00
8	Earnings per share (of Rs 10/- each) (a) Basic (Rs.) (b) Diluted (Rs.)	(5.83) (5.83)	(9.31) (9.31)	(4.25) (4.25)

tract of financial results of PPAP Automotive Limited (Standalone Information)  (Hs. In lakh						
Particulars	Quarter Ended	Year Ended	Year Ended			
	31-Mar-2024	31-Mar-2024	31-Mar-2023			
	Audited (Ref. Note 5)	Aud	ited			
Revenue from operations	13,227.70	50,386.22	49,232.17			
Net Profit / (Loss) for the period before tax	192.20	321.70	901.32			
Net Profit / (Loss) for the period after tax	(597.82)	(467.25)	681.02			

- The above is an extract of the detailed format of Quarterly / Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly / Annual Financial Results are available on the Stock Exchanges website (www.bseindia.com and www.nseindia.com) and on Company's website (www.ppapco.in). The above financial results were reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at their meeting held on
- 18<sup>th</sup> May, 2024. The above consolidated financial results includes results of PPAP Tokai India Rubber Private Limited, Joint Venture of the Company in which the Company
- holds 50% stake and two subsidiary companies. The Company together with its subsidiaries is herein referred to as the Group. The figures for the quarter ended 31st March, 2024 and 31st March, 2023 are the balancing figures between the audited figures in respect of the full financial year and the published unaudited year to date figures up to the third quarter of the respective financial year.
- The Group is primarily engaged in the business of manufacturing of automotive components, development and sale of plastic injection molds, development and sale of components for consumer goods, trading of automotive accessories, development and sale of Battery packs for Electric vehicles and storage application. The company operates only in one reportable segment i.e. automotive component as per Ind AS 108 (Operating Segment) and hence no separate disclosure is required for segments.
- The Board of Directors have considered and recommended a final dividend of Rs 1.25/- per equity share of Rs. 10/- each at their meeting held on 18th May, 2024, subject to the approval of shareholders in the ensuing Annual General Meeting.

For PPAP AUTOMOTIVE LIMITED

**Abhishek Jain** 

(CEO & Managing Director)

## JM FINANCIAL CREDIT SOLUTIONS LIMITED

Corporate Identity Number: U74140MH1980PLC022644 h Floor, Cnergy, Appasaheb Marathe Marg, Prabhadevi, Mumbai 400 025.

Tel. No.: +91 22 6630 3030 • Fax No.: +91 22 6630 3223

Website: www.imfinancialcreditsolutions.com

STATEMENT OF FINANCIAL DESLITE FOR THE OHARTER AND VEAR ENDED MARCH 24, 2024

JM FINANCIAL

_			Quarter Ended	Year Ended		
Sr. No.	Particulars	31.03.2024 (Refer Note 3)	31.12.2023 Unaudited	31.03.2023 (Refer Note 3)	31.03.2024 Audited	31.03.2023 Audited
1	Total Income from Operations	341.97	330.24	321.80	1,304.82	1,172.30
2	Profit before Tax for the period / year (before, Exceptional and / or Extraordinary items)	(85.67)	115.45	134.73	66.90	452.83
3	Profit before Tax for the period / year (after, Exceptional and / or Extraordinary items)	(85.67)	115.45	134.73	66.90	452.83
4	Net Profit for the period / year	(66.66)	86.36	100.01	47.16	334.75
5	Total Comprehensive Income	(144.45)	86.36	89.22	(43.31)	315.45
6	Paid up Equity Share Capital	2.83	2.83	2.83	2.83	2.83
7	Reserves (excluding Revaluation Reserve)	4,209.91	4,354.37	4,254.07	4,209.91	4,254.07
8	Securities Premium Account	1,715.28	1,715.28	1,715.28	1,715.28	1,715.28
9	Net Worth	4,212.74	4,357.20	4,256.90	4,212.74	4,256.90
10	Outstanding Debt	6,050.92	5,927.97	6,282.88	6,050.92	6,282.88
11	Outstanding Redeemable Preference Shares	None	None	None	None	None
12	Debt Equity Ratio	1.44	1.36	1.48	1.44	1.48
13	Earnings Per Share					
	Basic EPS (in ₹) (Not annualised)	(235.82)	305.52	353.79	166.83	1,184.18
	Diluted EPS (in ₹) (Not annualised)	(235.82)	305.52	353.79	166.83	1,184.18
14	Capital Redemption Reserve	NA	NA	NA	NA	NA
15	Debenture Redemption Reserve	NA	NA	NA	NA	NA
16	Debt Service Coverage Ratio	NA	NA	NA	NA	NA
17	Interest Service Coverage Ratio	NA	NA	NA	NA	NA

- 1. The above results for the fourth quarter and year ended March 31, 2024, have been reviewed by the Audit Committee and on its recommendation, have been approved by the Board of Directors at its meeting held on May 18, 2024. The said results have been audited by the Statutory Auditors of the Company who have issued unmodified audit opinion thereon.
- 2. The above audited financial results have been prepared in accordance with the recognition and measurement principles laid down in the Ind AS notified under Section 133 of the Companies Act, 2013 read with relevant rules issued thereunder and other accounting principles generally accepted in India and as per format prescribed in Regulation 52 of the SEBI (Listing Obligations And Disclosure Requirements) Regulations, 2015, as amended read with operational circular for listing obligation and disclosure requirement dated July 29, 2022.
- 3. The figures for the quarter ended March 31, 2024 and March 31, 2023 in the above financial results are the balancing figures between the audited figures for the year ended March 31, 2024 and March 31, 2023 and the year to date unaudited figures published up to the nine
- The above is an extract of the detailed format of audited financial results filed with BSE Limited (BSE) and National Stock Exchange of India Limited (NSE) (collectively referred as Stock Exchanges) under Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (SEBI LODR). The full format of said financial results are available on the websites of BSE at
- www.bseindia.com and NSE at www.nseindia.com and on the website of the Company at www.jmfinancialcreditsolutions.com. 5. The other details required under Regulation 52(4) of the SEBI LODR have been submitted to the Stock Exchanges and can be accessed at www.bseindia.com and www.nseindia.com.

For and on behalf of the Board of Directors

Vishal Kampani Vice Chairman and Managing Director

Place: Mumbai Date: May 18, 2024 DIN: 00009079

Place: Noida Date: 18th May, 2024 Let's Grow Together months ended December 31, 2023 and December 31, 2022 respectively.